



# scienceexpress

## Climate Action Special

www.scienceexpress.in

21 ઓગષ્ટ 2017

પ્રતિ,

.....

વિષય: 'સાયન્સ એક્સપ્રેસ ક્લાઈમેટ એક્શન સ્પેશિયલ' પ્રદર્શની ટ્રેન

શ્રીમાન/શ્રીમતી,

સાયન્સ એક્સપ્રેસ ક્લાઈમેટ એક્શન સ્પેશિયલ (SECAS) એ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, રેલ્વે મંત્રાલય, ભારત સરકાર; ભારતીય વન્યજીવ સંસ્થા અને વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નો સંયુક્ત અભિગમ છે. આ એક વૈવિધ્યપૂર્ણ 16 વાતાનુકૂળિત કોચ ધરાવતી રેલગાડીમાં મહેલું આબોહવા પરિવર્તન તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયને કેન્દ્રિત કરતું અજોડ પ્રદર્શન છે.

સાયન્સ એક્સપ્રેસ એ ઓક્ટોબર 2007 થી, એટલેકે એના પ્રારંભથી અત્યાર સુધીમાં 525 સ્થળોના મુકમોએ 1.77 કરોડથી વધારે લોકોએ મુલાકાત લીધેલું સૌથી મોટું, લાંબા સમયથી ચાલતું અને સૌથી વધુ લોકો દ્વારા મુલાકાત લીધેલું ફરતું વિજ્ઞાન પ્રદર્શન છે. SECAS તરીકેના એના નવમા એટલેકે વર્તમાન તબક્કામાં આ ટ્રેન 17 ફેબ્રુઆરી થી 08 સપ્ટેમ્બર 2017 સુધી ભારતભરમાં 74 સ્થળોએ મુકામ કરશે. SECAS નું હવે પછીના અમુક દિવસોનું સમયપત્રક નીચે મુજબ છે:

ડીસા રેલ્વે સ્ટેશન	:	22 - 24 ઓગષ્ટ 2017
ભુજ રેલ્વે સ્ટેશન	:	25 - 27 ઓગષ્ટ 2017
ભક્તિનગર રેલ્વે સ્ટેશન	:	28 - 31 ઓગષ્ટ 2017
ગોંડલ રેલ્વે સ્ટેશન	:	01 - 04 સપ્ટેમ્બર 2017
ખોડિયાર રેલ્વે સ્ટેશન	:	05 - 08 સપ્ટેમ્બર 2017

પ્રદર્શન સમય : સવારે 10:00 થી સાંજે 05:00 સુધી

અમે આપ સૌને, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને SECASની મુલાકાત લેવા માટે આમંત્રિત કરીએ છીએ. આ પ્રદર્શન જોવા માટે કોઈ પ્રવેશ ફી નથી. વધુ માહિતી [www.scienceexpress.in](http://www.scienceexpress.in) પર ઉપલબ્ધ છે.

આપ [scienceexpress@gmail.com](mailto:scienceexpress@gmail.com) પર ઈ-મેઈલ કરી અથવા મોબાઈલ નંબર 09428405407, 09428405408 પર ફોન કરીને ટ્રેન પરની ટીમના સભ્યનો સંપર્ક સાધી શકો છો. આ સાથે નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા માટે સમયપત્રક સહિતની સંક્ષિપ્ત નોંધ અને ભીંતપત્ર બિડેલ છે.

ટ્રેન પરના આ પ્રતિષ્ઠિત પ્રદર્શનના બહોળા પ્રચાર માટે અમે આપ સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ જેથી મોટી સંખ્યામાં લોકો એનો લાભ લઈ શકે.

આપનો વિશ્વાસુ,

દિલીપ સુરકર

નિયામક, VASCSC

**Vikram A Sarabhai Community Science Centre**

Navrangpura, Ahmedabad - 380 009. Tel: +91 79 26302914, 26302085 E: [vascsc@gmail.com](mailto:vascsc@gmail.com) W: [www.vascsc.org](http://www.vascsc.org)